



ગુજરાત જાહેર સેવા આયોગ

અગત્યની જાહેરાત

આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ નીચે મુજબની વિગતની જાહેરાતોની પરીક્ષા યોજનાર છે. આ જગ્યાઓની પ્રાથમિક કસોટીનો અભ્યાસક્રમ આયોગની વેબસાઈટ <https://gpsc.gujarat.gov.in/> પર ઉપલબ્ધ છે.

ક્રમ	જાગ્યાનું નામ	જાહેરાત ક્રમાંક	પ્રાથમિક કસોટીની તારીખ અને સમય	પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાની તા
(૧)	(૨)	(૩)	(૪)	(૫)
૧	ગુજરાત વહીવટી સેવા, વર્ગ-૧, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-૧ અને વર્ગ-૨ તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ-૨- OMR	૨૦/૨૦૨૨-૨૩	૦૮-૦૧-૨૦૨૩ ૧૦:૦૦ થી ૬:૦૦	૨૭-૧૨-૨૦૨૨
૨	કાયદા અધિકારી, વર્ગ-૨, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિ.- CBRT	૧૬/૨૦૨૨-૨૩	૨૨-૦૧-૨૦૨૩ ૧૧:૦૦ થી ૨:૦૦	૧૧-૦૧-૨૦૨૩
૩	ક્યુરેટર, વર્ગ-૨-CBRT	૧૮/૨૦૨૨-૨૩	૨૨-૦૧-૨૦૨૩ ૧૧:૦૦ થી ૨:૦૦	૧૨-૦૧-૨૦૨૩
૪	ગુજરાત ઈજનેરી સેવા, વર્ગ-૧/૨, મા.મ.વિ.-ન.જ.પા.પુ. અને ક. વિ- OMR	૧૮/૨૦૨૨-૨૩	૨૨-૦૧-૨૦૨૩ ૧૧:૦૦ થી ૬:૦૦	૧૧-૦૧-૨૦૨૩
૫	હિસાબી અધિકારી, વર્ગ-૧- OMR	૨૧/૨૦૨૨-૨૩	૦૫-૦૨-૨૦૨૩ ૧૦:૦૦ થી ૬:૦૦	૨૪-૦૧-૨૦૨૩
૬	આદર્શ નિવાસી શાળા આચાર્ય, વર્ગ-૨, કમિશનર આદિજાતી વિભાગ OMR	૨૩/૨૦૨૨-૨૩	૦૫-૦૨-૨૦૨૩ ૧૧:૦૦ થી ૨:૦૦	૨૧-૦૧-૨૦૨૩
૭	ગુ.પા.પૂ. અને ગ.વ્ય. બોર્ડ (GWSSB) ઈજનેરી સેવા (સિવિલ), વર્ગ-૧ અને વર્ગ-૨ OMR	૨૪/૨૦૨૨-૨૩	૦૫-૦૨-૨૦૨૩ ૧૧:૦૦ થી ૬:૦૦	૨૫-૦૧-૨૦૨૩

નોંધ:

- (૧) જાહેરાત ક્રમાંક ૧૮, ૨૦, ૨૧, ૨૩ અને ૨૪/૨૦૨૨-૨૩ OMR પદ્ધતિથી લેવાશે. તે સિવાય તમામ જાહેરાતો મહદંશે Computer Based Recruitment Test (CBRT) પદ્ધતિથી લેવામાં આવશે, CBRT બાબતે અદ્યતન જરૂરી સુચનાઓ/માહિતી આયોગની વેબસાઈટ પર થી મેળવવાની રહેશે. CBRT પદ્ધતિથી લેવાતી પ્રાથમિક કસોટીઓ માટે ઉમેદવારોએ પરીક્ષાના દિવસે પરીક્ષા ખંડમાં પરીક્ષાના નિયત સમયથી એક કલાક પહેલાં અચૂક હાજર થવાનું રહેશે.
- (૨) ઉક્ત જાહેરાતોનાં તમામ ઉમેદવારોને આ કસોટીમાં કામચલાઉ ધોરણે ઉપસ્થિત થવા દેવાનો આયોગે નિર્ણય કરેલ છે. ઉપર્યુક્ત જાહેરાતોના સંબંધિત ઉમેદવારોએ કોલમ-૫ માં દર્શાવેલ તારીખે બપોરના ૧૩:૦૦ કલાકથી પરીક્ષાના દિવસે પરીક્ષા શરૂ થાય ત્યાં સુધીમાં પોતાના પ્રવેશપત્ર, હાજરીપત્ર તથા ઉમેદવારોની સુચનાઓ (પરિશિષ્ટ-૧ અને ૨) "Online" ડાઉનલોડ કરવાના રહેશે. તે સિવાય જા.ક. ૧૮, ૨૦, ૨૧ અને ૨૪/૨૦૨૨-૨૩ની પરીક્ષાઓ માટે સંબંધિત ઉમેદવારોએ ફક્ત પ્રવેશપત્ર અને ઉમેદવારોની સુચનાઓ (પરિશિષ્ટ-૧ અને ૨) જ ડાઉનલોડ કરવાના રહે છે જે પરીક્ષા ખંડમાં સાથે રાખવાનું રહેશે અને પરીક્ષા પૂર્ણ થયેથી ઉમેદવારોએ પરત લઈ જવાનું રહેશે.
- (૩) પ્રવેશપત્ર "Online" ડાઉનલોડ કરવા માટે ઉમેદવારોએ નીચે મુજબ તબક્કાવાર/સ્ટેપવાઈઝ કાર્યવાહી કરવાની રહે છે. (૧) <https://gpsc-ojas.gujarat.gov.in> પર જવું. (૨) "Call Letter/Form" >> "Preliminary Call Letter / Main Exam Call Letter / Form" પર "Click" કરવું. (૩) અહીં ઉમેદવારે પોતાની "Job Select" કરવી તથા "Confirmation Number" અને "Birth Date" ટાઈપ કરવાના રહેશે. (૪) હવે "Print Call Letter" પર "Click" કરી પ્રવેશપત્રની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે. હાજરી પત્રકમાં નોંધની અંદર પરિશિષ્ટ-૧ અને પરિશિષ્ટ-૨ પર "Click" કરવાથી ઉમેદવારની સુચનાઓ પરિશિષ્ટ-૧ અને પરિશિષ્ટ-૨ ની પ્રિન્ટ નીકળશે. આ તમામ દસ્તાવેજોની પ્રિન્ટ અચૂક કાઢવામાં આવે તેની નોંધ લેવી. પ્રવેશપત્ર અને હાજરીપત્રક અલગ અલગ કાગળ પર પ્રિન્ટ કરવાના રહેશે. પરીક્ષા સમયે બંને સાથે લાવવાના રહેશે. ફોટોવાળું હાજરીપત્રક પરીક્ષા ખંડમાં પરત સોંપવાનું રહેશે. જે ઉમેદવારોના ફોટા હાજરી પત્રકમાં સ્પષ્ટ જોઈ શકાય તેવા આવેલા ન હોય તેવા ઉમેદવારોએ પોતાનો પાસપોર્ટ સાઈઝનો તાજતરનો ફોટો પરીક્ષા કેન્દ્ર પર લાવવાનો રહેશે. આ ફોટો ઉમેદવારનો પોતાનો છે તેની સ્પષ્ટતા માટે ફોટોવાળું આગળપત્ર સાથે રાખવું આવશ્યક છે.

ખાસ નોંધ:- પોસ્ટ-ઓફિસમાં/ઓનલાઈન અરજી ફી ભરેલ નથી તેવા બિનઅનામત કક્ષાના ઉમેદવારો પ્રવેશપત્ર ડાઉનલોડ કરી શકશે નહીં. આ ઉમેદવારોએ પ્રથમ આયોગની કચેરી (સરનામું: એરફોર્સ કચેરીની સામે, છ-૩ સર્કલ પાસે, 'છ' રોડ, સેક્ટર-૧૦-એ, ગાંધીનગર) ખાતે પરીક્ષાના આગલા કામ કાજના દિવસ સુધીમાં કચેરી સમય દરમ્યાન રૂબરૂમાં આવી પ્રોસેસ ચાર્જ રૂ.૫૦૦/- રોકડેથી ભરવાના રહેશે અથવા <https://gpsc-ojas.gujarat.gov.in> માં ->FEES MODULE માં->PROCESSING FEE TO UNBLOCK CALL LETTER માં જઈને, જાહેરાતની પસંદગી કરીને, કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખીને ઓનલાઈન પ્રોસેસ ચાર્જ રૂ. ૫૦૦ ભરવાના રહેશે. જો કોઈ કારણસર આ પદ્ધતિ થી આપના રૂપિયા ચૂકવ્યા પછી પણ પ્રવેશપત્ર ન નીકળે તો આપે આજ મોડયૂલમાં વિગતો ભરીને "CHECK YOUR PAYMNET STATUS" પર ક્લિક કરીને સ્થિતી જાણી લેવી. ત્યારબાદ જ પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાની પરવાનગી આપી શકાશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી. જે ઉમેદવારોના અરજીપત્રક કન્ફર્મ થયેલ હોય અને સમય મર્યાદામાં અરજી ફી ભરેલ હોય, છતાં પ્રવેશપત્ર ડાઉનલોડ થતો ન હોય અથવા વેબસાઈટ પર "Application Not Found" નો મેસેજ આવતો હોય તેવા ઉમેદવારોને પરીક્ષાના આગલા કામકાજના દિવસ સુધીમાં આયોગની કચેરી ખાતે કચેરી સમય દરમ્યાન અરજી કર્યાના પુરાવા સહિત રૂબરૂ સંપર્ક સાધવા જણાવવામાં આવે છે અથવા ps2sec-gpsc-ahd@gujarat.gov.in પર નાણા ભર્યાની પહોંચ સાથે જાહેરાત ક્રમ, કન્ફર્મેશન નંબર અને અરજી નંબરની વિગત મોકલવી.

તારીખ:- ૨૬/૧૨/૨૦૨૨